

રાજકોટ મહાનગરપાલિકા

ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧

અખબારી યાદી

તા.૧૪-૦૭-૨૦૨૨

• રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 'હરીયોગી લાઈવ પફ' - પટેલ ચોક, હરિધવા મેઇન રોડ , રામેશ્વર વાડીની બાજુમાં , રાજકોટ મુકામેથી ઉત્પાદન કરેલ 'પફ માટેનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ ફૂડ)' નો નમુનો રિએનાલિસિસ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક-ગૌરવ પ્રકાશભાઈ રૂપારેલીયાને રૂ.૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) દંડનો હુકમ કરવામાં આવેલ છે.

• ફૂડ વિભાગ દ્વારા 'ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ' -આર્યનનગર-૧ , ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ, બાલક હનુમાન પાસે, રાજકોટ મુકામેથી લેવાયેલ 'તીખી પાપડી (ફરસાણ -લુઝ)' ના નમુનામાં રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થયેલ જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર- પેઢીના સંચાલક શ્રી ભાવેશભાઈ સામતભાઈ કારેણાને રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર પુરા)નો દંડ તથા પેઢીના માલિક શ્રી દિલીપભાઈ સામતભાઈ કારેણાને રૂ.૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચીસ હજાર પુરા)નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

• ફૂડ વિભાગ દ્વારા 'રૂપકલા નોવેલ્ટી સ્ટોર' - મનહર પ્લોટ ૬/૭ , મંગળા રોડ , રાજકોટ મુકામેથી લેવાયેલ 'ભેસનું શુધ્ધ ઘી (લુઝ)' ના નમુનામાં રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી

રાજકોટ દ્વારા નમુનો આપનારશ્રી રસીકભાઈ બાબુભાઈ સવસાનીને રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર પુરા) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

• ફૂડ વિભાગ દ્વારા 'કિશ્ના ધી ભંડાર' - ગરબી ચોક , કેવડાવાડી મેઇન રોડ , રાજકોટ મુકામેથી લેવાયેલ 'ભેસનું શુધ્ધ ધી (લુઝ)' ના નમુનામાં રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનારશ્રી કમ્લેશભાઈ હરજીવનભાઈ તન્નાને રૂ.૫૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા)નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

• ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મંગળા મેઇન રોડ , વિદ્યાનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૫ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

(૧)જલારામ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૨)ઝરીયા પાન -લાઇસન્સ બાબતે નોટિસ (૩)ઠાકર ફાસ્ટફૂડ -લાઇસન્સ બાબતે નોટિસ (૪)સારથી ફાર્મસી-લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)વેદ મેડીસીન -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

તથા (૦૬) જનતા બેકરી (૦૭)પટેલ પાન (૦૮)મહેન્દ્રભાઈ પોપટભાઈ (૦૯)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૦)અરિહંત નમકીન (૧૧)આર. કે. શોપિંગ પોઈન્ટ (૧૨)મનોહર મેડિકલ (૧૩)શ્રીજી ડાયનિંગ હોલ (૧૪)અમૃત જનરલ સ્ટોર (૧૫)રજાણી પ્રોવિઝન સ્ટોર (૧૬)શ્રદ્ધા મેડિસિન્સ (૧૭)મેઘા મેડિસિન્સ (૧૮)ખોડિયાર મેડિસિન્સ (૧૯)ગણેશ મેડિસિન્સ (૨૦)શ્રી મેડિકલની ચકાસણી કરવામાં આવેલ.

ડેઝીઝ્નેટેડ ઓફિસર
રાજકોટ મહાનગરપાલિકા